

BCC:ISD:115:16:113

31.05.2023

<p>The Vice President B S E Ltd., Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai - 400 001 BSE Code-532134</p>	<p>The Vice President, National Stock Exchange of India Ltd. Exchange Plaza, Bandra Kurla Complex Bandra (E), Mumbai - 400 051 NSE Code-BANKBARODA</p>
---	--

Dear Sir / Madam,

Re: 27th AGM - Notice published in the Newspaper

Our 27th Annual General Meeting (AGM) is scheduled to be held on 07th July 2023 at 11.00 a.m. through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

We enclose newspaper advertisement published in Business Standard and Indian Express in English, Business Standard in Hindi, Sandesh in Gujarati, on 31.05.2023 for Notice to Shareholders of the 27th AGM.

We request you to take a note of the above pursuant to SEBI (LODR) Regulations, 2015 and upload the information on your website.

Yours faithfully,

P K Agarwal
Company Secretary

➤ **Advertisement published in Business Standard (English) on 31.05.2023:**

14

MUMBAI | WEDNESDAY, 31 MAY 2023 **Business Standard**


What India splurged on during IPL 2023

Biryani remains the most-ordered dish on delivery platform Swiggy, during the cricketing extravaganza, which came to a close in the wee hours of Tuesday

If you thought pizza was on top of the mind of most Indians glued to the television set while watching on their daily diet of Twenty20 cricket, the Indian Premier League (IPL) season, you could not be more wrong. It was biryani that was once again the "most ordered dish" on Swiggy, shows data released by the food aggregator, which served a staggering 12 million biryani orders. That's 12 orders per minute for the famous rice dish, says that firm.

All. After Ravindra Jadeja's fireworks brought down curtains on the two-month extravaganza, including Chennai Super Kings hit its record-qualifying fifth title, food aggregator platform Swiggy shared what the country ate as they watched the matches. While some of the data point to some intriguing trends so far as ordering during the games concerned, some orders were record-breaking.

COMPILED BY SHIVANI SHINDE



- Biryani managed to yet again become the "most ordered dish" with 12 mn orders, or 21.2 orders per minute
- For every onavg biryani, a staggering 20 non-veg biryani were ordered

- The fastest delivery this season took only 77 seconds and was done in Kolkata
- A person based in Delhi ordered 701 samosas, the most in a single order during the season

- Bengaluru dominated the food landscape with over 12 million orders during this cricketing season
- Swiggy's fleet of delivery partners traveled a total of 33 crore kilometers throughout the season

- 2,423 condoms were delivered
- Chennai ordered 3,641 units of dahi and 720 units of shokkar

- 368,353 orders for jalebi and fattas were received during the season

APPOINTMENTS

MCX METAL & ENERGY
TRADE WITH TRUST

Exchange: Soin, Chakla, Anand (Guj), Mumbai - 400 001. www.mcxindia.com

MULTI COMMODITY EXCHANGE OF INDIA LTD
seeks to appoint a
CHIEF REGULATORY OFFICER (CRO)

Qualified: COKRVA/MSBA, having 20+ years' leadership experience in Regulatory Compliance in all areas of the Exchange, dealing with Regulatory and Government Agencies, managing all activities related to Membership, Compliance, Arbitration/Institution, Grievance/Member Inspection, Market Surveillance & Investigations, Trade Compliance, Risk Management and Exchange Compliance/Implementation of orders, directions, guidelines issued by Registrar, Compliances with SCRA/SECC regulations, FEMA and 2008 Act & related of provisions, currently preferably working with large Financial Services Firm (exchange, capital markets, banking, etc.)

To know more about the role, please visit the Company Website Career section @ <https://www.mcxindia.com/careers/jobs-positions>

To apply, please email your latest resume with profile synopsis and current remuneration to: careers@mcxindia.com within 7 days.

Contact: Mr. Tulika Prasad

MCX METAL & ENERGY
TRADE WITH TRUST

Exchange: Soin, Chakla, Anand (Guj), Mumbai - 400 001. www.mcxindia.com

MULTI COMMODITY EXCHANGE OF INDIA LTD
seeks to appoint a
CHIEF TECHNOLOGY OFFICER (CTO)

Looking for a seasoned professional with strong business acumen to play an integral role in steering the company's technology strategy, development and future growth.

Qualified: BE / MCA / M Tech / MS; having 20+ years' experience in technology space, of which at least 5 years should be in senior management position leading large projects in Capital Markets, Financial Services and IT / IT enabled services firms and handling multiple stakeholders (Internal - Board level committees, external regulator, technology vendors and service partners).

To know more about the role, please visit the Company Website Career section @ <https://www.mcxindia.com/careers/jobs-positions>

To apply, please email your latest resume with profile synopsis and current remuneration to: careers@mcxindia.com within 7 days.

Himatsingka

EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023

(₹ in Lacs)

Particulars	Quarter Ended on 31.03.2023		Quarter Ended on 31.03.2022		Financial Year Ended on 31.03.2023		Financial Year Ended on 31.03.2022	
	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited
Revenue from operations	68,965	73,678	76,478	2,67,774	2,67,774	3,18,395		
Net Profit / (Loss) for the period before tax	3,587	325	2,047	(7,522)	(7,522)	21,032		
Net Profit / (Loss) for the period after tax	2,236	220	894	(9,407)	(9,407)	14,082		
Total comprehensive income / (loss) for the period (Comprising Profit / (Loss) for the period (after tax))	3,527	2,954	1,323	(1,577)	(1,577)	15,942		
P&M-up equity share capital (Face value Rs. 5 per share)	4,923	4,923	4,923	4,923	4,923	4,923		
Reserves excluding revaluation reserves						1,38,878	1,42,048	
Earnings per share (not annualised except year ended 31.03.2023 and 31.03.2022) - in Rupees								
a) Basic	2.27	0.22	0.82	(6.51)	(6.51)	14.30		
b) Diluted	2.27	0.22	0.82	(6.51)	(6.51)	14.30		

Notes:

- Key Statisticians financial information of the Company is given below:

Particulars	Quarter Ended on 31.03.2023		Quarter Ended on 31.03.2022		Financial Year Ended on 31.03.2023		Financial Year Ended on 31.03.2022	
	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited
1A. Revenue from Operations	65,909	54,810	74,958	2,05,274	2,05,274	2,85,898		
1B. Profit / (Loss) before tax	3,479	235	2,030	(4,234)	(4,234)	22,384		
1C. Profit / (Loss) after tax	2,123	135	1,305	(3,019)	(3,019)	15,433		
1D. Total comprehensive income / (Loss)	3,795	1,444	750	(3,781)	(3,781)	15,578		

2. The above is an extract of the detailed format of Audited Statisticians and Consolidated results for the quarter and year ended on March 31, 2023 filed with the Stock Exchanges under Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Audited Statisticians and Consolidated results for the quarter and year ended on March 31, 2023 are available on the website of the Stock Exchanges (www.sebiindia.com) and the Company's website (www.himatsingka.com).

Place: Bengaluru
Date: May 30, 2023

Dinesh Himatsingka
Executive Chairman

Shrikant Himatsingka
Managing Director & CEO

Himatsingka Seide Limited
Registered Office: 10/2A, Kumara Krupa Road, High Grounds, Bengaluru - 560 001
T: +91-80-22378000, F: +91-80-41479384, E: investors@himatsingka.com, W: www.himatsingka.com
CIN: L17112KA1985PLCO06647

INSPIRED EXCELLENCE

NOTICE

27th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM)

Shareholders of the Bank may note that in pursuance of Circular(s) issued by Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India (SEBI) in this regard, the 27th Annual General Meeting (AGM) of the Bank will be held through VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM) on Friday, 07th July, 2023 at 11:00 a.m. IST, to transact the businesses that will be set forth in the Notice of the Meeting.

In compliance with the above Circulars, electronic copies of the Notice of AGM and Annual Report 2022-23 will be sent to all the shareholders whose email addresses are registered with the Bank/Depository Participant(s). Shareholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode are requested to demat their holdings / furnish their email addresses and mobile numbers with KFIn Technologies Limited, the Bank's Registrar and Share Transfer Agent, at elw@kfintech.com. The notice of the 27th AGM and Annual Report 2022-23 will also be made available on the Bank's website, at www.bankofbaroda.in, the Stock Exchange website and on the RTA's website, at <https://evoting.kfintech.com>

Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders. The details will also be made available on the website of the Bank. Shareholders are requested to visit www.bankofbaroda.in to obtain such details.

Shareholders may please note that in terms of aforementioned circulars, the Bank will not be sending physical copies of AGM Notice and Annual Report to the Shareholders.

Shareholders are also requested to update their Bank Account details in Folio / Demat Account to receive Dividend 2022-23.

For Bank of Baroda
Sanjiv Chadha
Managing Director & CEO

Place: Mumbai
Date: 31.05.2023

INDUSTRIAL PROPERTY FOR SALE

At Ranjanagan MIDC in 'A' Block, Plot Area 15000 sq. mtr. Constructed Area is 6958 sq. mtr.

For more information
Contact : Ravikiran Patke
Mob. : +91 89808 66666

TENDER NOTICE

Bank of Baroda invites proposal for following:

S No	Tender Name	Last date for submission of bids
1	RFP for Supply, Implementation & Maintenance of Universal Reconciliation Management System	27.06.2023

Details are available on Bank's website www.bankofbaroda.in under Tenders section and GEM portal. "Addendum", if any, shall be published on Bank's website www.bankofbaroda.in under Tenders section. Bids must refer the same before final submission of the proposal.

Place: Mumbai
Date: 31.05.2023
Chief General Manager (IT)

insecticides (INDIA) LIMITED

Regd. Office: 401-406, Lasa Tower, Azadpur Commercial Complex, Delhi-110 033; Tel: 011-2787700-05
Website: www.insecticidesindia.com, Email: investor@insecticidesindia.com, CIN: L65901DL1996PLC083909

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023

(₹ in Lacs, except EPS)

Sl. No.	Particulars	Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
		31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022	31.03.2023	31.03.2022
1	Total Revenue from Operations	3,00,000	2,80,000	3,00,000	1,00,000	3,00,000	1,00,000	3,00,000	1,00,000
2	Net Profit for the period (before tax)	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000
3	Net Profit for the period (after tax)	80,000	80,000	80,000	80,000	80,000	80,000	80,000	80,000
4	Total Comprehensive Income for the period (after tax) and Other Comprehensive Income (after tax)	80,000	80,000	80,000	80,000	80,000	80,000	80,000	80,000
5	P&M-up Equity Share Capital (Face Value of ₹10 per share)	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000	1,00,000
6	Reserves (including Revaluation Reserve)								
7	Earnings per Equity Share (Face Value of ₹10 per share)	8.00	8.00	8.00	8.00	8.00	8.00	8.00	8.00

NOTES:

- The figures are in terms of the detailed format of Audited Statisticians and Consolidated Financial Results for the Quarter and Year ended March 31, 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended. The full format of the Audited Statisticians and Consolidated Financial Results and Company's website www.insecticidesindia.com.
- The above Audited financial results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS), the provisions of the Companies Act, 2013 ("the Act"), as applicable and guidelines issued by the Securities and Exchange Board of India (SEBI).
- The Ind AS are prepared under Section 133 of the Act read with the Rules framed thereunder (Indian Accounting Standards, 2015) (Indian Accounting Standards).
- Further to the approval from Members, the Authorized share capital of the Company was increased from ₹200 Lacs commencing from 2,00,00,000 equity shares of face value of ₹10/- each to ₹200 Lacs commencing from 2,00,00,000 equity shares of face value of ₹10/- each. Further, on October 06, 2022 the Board of Directors has authorized the issue of ₹100 Lacs of face value of ₹10/- each, by way of equity shares of face value of ₹10/- each and on the record date, by way of equity shares of face value of ₹10/- each. The full details of the increase in authorized share capital and the issue of equity shares of face value of ₹10/- each are available on the website of the Company at www.insecticidesindia.com.
- The details of the increase in authorized share capital and the issue of equity shares of face value of ₹10/- each are available on the website of the Company at www.insecticidesindia.com.

For and on behalf of the Board of Directors, Insecticides (India) Limited.

(Place: Mumbai)
Date: 30/05/2023

➤ **Advertisement published in Indian Express (English) on 31.05.2023:**

WWW.INDIANEXPRESS.COM
THE INDIAN EXPRESS, WEDNESDAY, MAY 31, 2023

7

कार्यालय अति. महानिदेशक पुलिस
(मानव संसाधन विभाग) राजस्थान, जयपुर
आवक: 3102/2023/सकल/2023/ दिनांक: 13.05.2023

गुमशुदा की तलाश

नाम: सीमा
पिता: दीवान राम
दुर्घटना नमूना: उम्र 16 साल, रंग
गौर, ऊंच-5 फिट
2 इंच, महिला बदन
गौर बाल

निवेदी: 10-300 डीडी बीडी इन्सुलन नगर पुलिस थाना - पुरत
पिता श्रीमान:

आप अपने अपने क्षेत्र में गुमशुदा की खोज करके जमाने पर निम्न की
पुचवा करके लाने का है।

पुलिस अधीक्षक (एच.जी.)
पुरत पुलिस थाना
फोन नं. 3851-226111 पोल नं. 3141-2748354

SBI
NBFC Alliance, Corporate Centre, 1st Floor, B Wing, Rajgaj Chambers,
10th Floor, 10th Cross, 10th Main Road, Bangalore, Karnataka 560022

REQUEST FOR APPLICATION FOR EMPANELMENT OF BUSINESS ASSOCIATES
RFP No. NBFCALLIANCE/2023/24/1 (dated 30.05.2023)

Applicants are invited by State Bank of India from the eligible entities for
engagement as Business Associates for sourcing/handling of NBFC Asset
Products under Agri. For details, please visit "Procurement News" at
<http://www.sbi.com/procurement>

Commencement of download of Application Form: 30.05.2023.
Last date and time for submission of Application: 29.06.2023 up to 18:00 hrs.
NBFC Alliance Department

SBI
Anytime Channels, Corporate Centre, 3rd Floor,
World Trade Centre Arcade, Cuff Parade, Mumbai - 400006

NOTICE INVITING BIDDERS
Bidders are invited by State Bank of India under RFP No. SBI/CV/2023-
24/001 dated 31.05.2023 from the eligible bidders for procurement
of 6750 Branch managed CAPEX ATM's under Phase XV. Bidders, who are
intended to submit bids, may visit "Procurement News" on the
Bank's web site <http://www.sbi.com/procurement>

Commencement of download of RFP: From 05:00 PM on 31.05.2023
Last date and time of submission of bids: Up to 03:00 PM on 21.06.2023
Till 4

Place: Mumbai
Date: 31.05.2023

Deputy General Manager
(Implementation & Rollout)

Gujarat Mineral Development Corporation Ltd.
(A Government of Gujarat Enterprise)
CIN: L1900GJ1963GOC0006
Kharaj Bhavan, 132 Feet Ring Road, Near University Ground, Vastropur, Ahmedabad - 380 052

AUDITED FINANCIAL RESULTS
FOR THE QUARTER / YEAR ENDED ON MARCH 31, 2023
(The Regulations 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015)

Sr. No.	Particulars	STANDALONE			
		Quarter ended on		Year ended on	
		31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2022 (Audited)	31-03-2022 (Audited)
1	Total Income from Operations (net)	95,175.95	85,541.08	1,05,728.00	3,50,144.75
2	Net Profit for the period (before Tax and Exceptional items)	61,618.80	37,055.50	46,378.85	1,45,717.18
3	Net Profit for the period (before Tax (after Exceptional items))	61,618.80	37,055.50	46,378.85	1,45,717.18
4	Net Profit for the period after tax (after Exceptional items)	45,070.08	26,626.89	21,671.24	1,21,247.53
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period after tax and Other Comprehensive Income (after tax))	40,147.59	24,296.60	36,342.30	1,11,017.15
6	Equity Share Capital	6,360.00	6,360.00	6,360.00	6,360.00
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet)			5,69,581.18	4,72,238.03
8	Earning Per Share (of ₹2/- each) (for continuing and discontinued operations) (net annualised):				
	1. Basic (₹)	14.17	8.37	6.81	38.13
	2. Diluted (₹)	14.17	8.37	6.81	38.13

Sr. No.	Particulars	CONSOLIDATED			
		Quarter ended on		Year ended on	
		31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2022 (Audited)	31-03-2022 (Audited)
1	Total Income from Operations (net)	95,175.55	85,541.08	1,05,728.00	3,50,144.75
2	Net Profit for the period (before Tax and Exceptional items)	61,636.69	37,105.98	46,413.81	1,45,799.02
3	Net Profit for the period (before Tax (after Exceptional items))	61,636.69	37,105.98	46,413.81	1,45,799.02
4	Net Profit for the period after tax (after Exceptional items)	45,328.70	26,728.11	21,791.91	1,21,573.46
5	Total Comprehensive Income for the period (Comprising Profit for the period after tax and Other Comprehensive Income (after tax))	40,306.21	24,395.82	36,532.23	1,11,343.08
6	Equity Share Capital	6,360.00	6,360.00	6,360.00	6,360.00
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet)			5,73,446.11	4,75,799.03
8	Earning Per Share (of ₹2/- each) (for continuing and discontinued operations) (not annualised):				
	1. Basic (₹)	14.22	8.41	6.85	38.23
	2. Diluted (₹)	14.22	8.41	6.85	38.23

Subject to Audit as per 14(3)(b) of the Companies Act, 2013 by CA&A of India.
Note: The above is an extract of the detailed format of Financial Results for the quarter / year ended on 31st March 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 and SEBI Circular No. CIR/CFD/FAC/62/2014 dated 07th July 2016. The full format of the Financial Results for the quarter / year ended on 31st March 2023 along with Supplementary Notes is available on the Stock Exchange websites. www.nseindia.com and www.bseindia.com.

Place: Ahmedabad
Date: 30.05.2023

For and on behalf of the Board of Directors
Rajwanti Singh, IAS
Managing Director

75
Azadi Ka Amrit Mahotsav
www.bankofbaroda.in

NOTICE
27th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM)

Shareholders of the Bank may note that in pursuance of Circular(s) issued by Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India (SEBI) in this regard, the 27th Annual General Meeting (AGM) of the Bank will be held through VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM) on Friday, 07th July 2023 at 11:00 a.m. IST. To transact the businesses that will be set forth in the Notice of the Meeting.

In compliance with the above Circulars, electronic copies of the Notice of AGM and Annual Report 2022-23 will be sent to all the shareholders whose email addresses are registered with the Bank Depository (DP) and Shareholders. Shareholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode are requested to demat their holdings / furnish their email addresses and mobile numbers with KF-In Technologies Limited, the Bank's Registrar and Share Transfer Agent, at sharewardra@kfintech.com. The notice of the 27th AGM and Annual Report 2022-23 will also be made available on the Bank's website, at www.bankofbaroda.in, the Stock Exchange websites and on the RTA's website, at www.kfintech.com.

Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of voting remotely for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders. The details will also be made available on the website of the Bank. Shareholders are requested to visit www.bankofbaroda.in to obtain such details.

Shareholders may please note that in terms of aforementioned circulars, the Bank will not be sending physical copies of AGM Notice and Annual Report to the Shareholders.

Shareholders are also requested to update their Bank Account details in Folio / Demat Account to receive Dividend 2022-23.

Place: Mumbai
Date: 31.05.2023

For Bank of Baroda
Sanjiv Chadha
Managing Director & CEO

GoSchool: Affordable International Education ADVERTORIAL

GoSchool is an innovative international school that revolutionizes the traditional education system, offering a refreshing alternative to a traditional high school. GoSchool combines high-quality teaching, personalized attention, extracurricular activities, test preparation, international university admissions counseling, and cutting-edge skills to provide a transformative high school experience.

We deliver an exceptional education through our meticulously designed and proven curriculum, coupled with advanced learning methodologies within an engaging environment. GoSchool is the ideal choice for ambitious students striving for global career success. By integrating career preparation and world-class academics, we aim to create a generation of adaptable learners who are well-equipped to thrive in today's rapidly changing world. Our mission is to bridge the gap between career readiness and academic excellence found in traditional schools by blending customized career preparation with international faculty and career coaching.

Our experienced and inspirational global faculty offers rigorous instruction, combined with personalized assistance and progress monitoring, enabling students to excel and realize their full potential. Additionally, our student success coaches guide students in deepening their academic focus and raising their success bar.

At GoSchool, we prioritize giving high school students the flexibility to prepare for their chosen careers while earning their high school diploma with a profound understanding of their preferred academic subjects. Through our holistic curriculum and diverse range of subject choices, each student embarks on a customized learning pathway.

We provide an interactive environment enriched with cutting-edge technology, interactive teaching methods, the prestigious Pearson Edexcel qualification, a variety of extracurricular activities, and individualized attention. This ensures a complete and holistic high school experience.

GoSchool is the perfect choice for aspiring, innovative, and independent thinkers who aim to pursue careers in creative fields such as visual arts, performing arts, design, film, photography, entrepreneurship, media, journalism, fashion, and social media. Sports prodigies, preferring to invest their time and energy in sports rather than the classroom, will find GoSchool to be the ideal institution for balancing their athletic ambitions with a high-school qualification.

The international curriculum and global exposure provide a significant advantage to students aspiring to pursue undergraduate studies abroad, helping them familiarize themselves with the Western style of teaching and learning. GoSchool is a blessing for students who may struggle with the inflexible and rigorous curriculum and schedule typically found in traditional brick-and-mortar schools.

At GoSchool, we offer the Pearson Edexcel International A Level qualification, which follows the acclaimed British Curriculum. Pearson Edexcel is globally recognized for integrating world-class educational content and assessment with services and technology, facilitating effective teaching and personalized learning on a large scale. With Pearson Edexcel A Level qualification, students have the opportunity to pursue further studies in India or anywhere around the world.

GoSchool is initiative of the Ajeenkya D Y Patil Group (ADYPG). Mrs. Taruna Maheshwari and Prof. Hridayash Deshpande are the Co-Founders of GoSchool within the group. Mr. Hywel Bennett is the Academic Director. He is an highly experienced British educational practitioner with over 35 Years of experience in the UK and overseas teaching, and has led learning in China, Nigeria, Germany, and Kuwait with a wide range of curricula.

GoSchool is currently accepting applications for the A-Levels program (11th & 12th) and is offering attractive scholarships to deserving candidates.

To learn more about GoSchool's innovative approach to education, please feel free to reach out to our Admissions Counsellors at +91 95136 32638 or please visit our website at www.go-school.in




12 आयाम

नई दिल्ली | बुधवार, 31 मई 2023 | बिज़नेस स्टैंडर्ड

मणिपुर: शाह ने की कई लोगों से बात

सरकार ने मृतकों को 10 लाख रुपये मुआवजा और परिवार के एक सदस्य को नौकरी की घोषणा की

केंद्र शाह ने मणिपुर के शाह परिवार के सदस्यों से मुआवजा और नौकरी की घोषणा की...



गृह मंत्री ने की बैठक... मणिपुर के शाह परिवार के सदस्यों से मुआवजा और नौकरी की घोषणा की...

आरबीआई ने किया आगाह पर ऐप स्टोर पर अब भी ईटीपी

सोम सेले

आरबीआई ने गूगल प्ले और ऐप स्टोर पर अपने ऐप को डालने के लिए आगाह किया...

गूगल प्ले और ऐप स्टोर पर अपने ऐप को डालने के लिए आगाह किया...

कर्नाटक के तर्ज पर मप्र का चुनाव लड़ेगी कांग्रेस

संघीय चुनाव

कर्नाटक विधानसभा चुनाव में भारतीय जनता पार्टी (BJP) के विरुद्ध कांग्रेस ने चुनौती दी...

Bank of Baroda advertisement featuring a table with financial data, a bar chart, and promotional text for various services.

हरिद्वार से दिल्ली लौटे पहलवान

हरिद्वार से दिल्ली लौटे पहलवान... दिल्ली पुलिस द्वारा हरिद्वार में हुए एक कार्यक्रम के दौरान पहलवानों को दिल्ली लौटाने में मदद की...

Insecticides advertisement including a table with insecticide names, their uses, and contact information for the manufacturer.

➤ Advertisement published in Sandesh (Gujarati) on 31.05.2023:

શૈલેશ પટેલની હત્યા કેસમાં ૨૧ દિવસે પાંચ ઝડપાયા. શાપ્થૂટનો ફરાર અંગત અદાવતમાં વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખની હત્યા માટે ૧૮ લાખની સોપારી

ખાઈક પર આવેલા શાપ્થૂટનો એ રાતા મંદિર પાસે ફાયરિંગ કર્યું હતું

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેશ પટેલની હત્યા કેસમાં ૨૧ દિવસે પાંચ ઝડપાયા. શાપ્થૂટનો ફરાર અંગત અદાવતમાં વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખની હત્યા માટે ૧૮ લાખની સોપારી

આ અંગત અદાવતના કારણે શૈલેશ પટેલની હત્યા થઈ હતી. આ અંગત અદાવતના કારણે શૈલેશ પટેલની હત્યા થઈ હતી. આ અંગત અદાવતના કારણે શૈલેશ પટેલની હત્યા થઈ હતી.

સિતી રાજકોટમાં ક્રાઈમ ડિવેન્ડે હજારની નોટ લેવાની ના પાડી છે હજારની નોટનો કડકાટ: વડોદરા, રાજકોટમાં મામલો પોલીસમાં પહોંચ્યો

વડોદરામાં ક્રાઈમ ડિવેન્ડે હજારની નોટ લેવાની ના પાડી છે હજારની નોટનો કડકાટ: વડોદરા, રાજકોટમાં મામલો પોલીસમાં પહોંચ્યો

હવે હોટલ, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રોનો વારો ટેલિકોમ કંપનીઓના બાકી ૨.૨૧ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક પગલાં લેવાશે

હવે હોટલ, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રોનો વારો ટેલિકોમ કંપનીઓના બાકી ૨.૨૧ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક પગલાં લેવાશે

શ્રીકૃષ્ણ પટેલની હત્યા કેસમાં ૨૧ દિવસે પાંચ ઝડપાયા. શાપ્થૂટનો ફરાર અંગત અદાવતમાં વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખની હત્યા માટે ૧૮ લાખની સોપારી

સિતી રાજકોટમાં ક્રાઈમ ડિવેન્ડે હજારની નોટ લેવાની ના પાડી છે હજારની નોટનો કડકાટ: વડોદરા, રાજકોટમાં મામલો પોલીસમાં પહોંચ્યો

હવે હોટલ, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રોનો વારો ટેલિકોમ કંપનીઓના બાકી ૨.૨૧ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કડક પગલાં લેવાશે

બેંક ઓફ વડોદરા Bank of Baroda

વેક્રિય સુવિધા, રૂબરૂના તંત્રના કાર્યવાહીનો આશ્રય ભાવનગરમાં ધોધા રોડ પરના ઝૂંપડા તોડવાના નિર્ણયને HCCમાં પડકારાશે

INDEXTU (A Govt. of Gujarat Organisation) Industrial Extension Bureau

બેંક ઓફ વડોદરા Bank of Baroda

SET SAIL ON THE AGNIPATH BECOME AN AGNIVEER

JOIN INDIAN NAVY Indian Navy invites online applications for unmarried male and unmarried female candidates